

**D. D. THAKAR ARTS & K. J. PATEL COMMERCE COLLEGE,  
KHEDBRAHMA-383255**



(RUN BY ARAVALLI VIDYABHAVAN TRUST)

Prin. Dr.V. C. Ninama

Mo. 09427365308

College Road, Khedbrahma (N.G.), Pin: 383255, Website: <http://ackhed.org> E-mail:  
[ackhed1987@yahoo.com](mailto:ackhed1987@yahoo.com) (NAAC Accredited Grade: `B` With 2.73 Points: CPE Awarded )

"A" Grade { CGPA : 3. 33 } in AAA of KCG Gujarat

**ANNUAL REPORT: YEAR : 2020-21**

**વાર્ષિક અહેવાલ તથા પ્રમાણપત્ર-પ્રાપ્ત વિદ્યાર્થીઓની યાદી : ૨૦૨૦-૨૧**

ડી. ડી. ઠાકર આર્ટ્સ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજનું ખાતમુહૂર્ત ૧૯૮૬માં પરમ પૂજ્ય દેવીશ્રી ચંદુબાના વરદ હસ્તે થયું હતું. આજે એ ઘટનાને ૩૪ વર્ષ પૂરાં થઈ ગયાં તેનો આનંદ વ્યક્ત કરું છું. આ કોલેજ શરૂ થયા પછી તેના ધુરાવાહકોની દીર્ઘદૃષ્ટિ, આશીર્વાદ તથા વિશ્વાસુ સહકારથી દિનબદિન પ્રગતિ સાધતી રહી છે. આ દરમિયાન સંસ્થાએ અનેક સિદ્ધિ હાંસલ કરી છે. અનેક વિદ્યાર્થી આ સંસ્થામાંથી શિક્ષણ મેળવીને વિવિધ પદ/હોદ્દા પર પહોંચ્યાં છે. કોલેજનાં પ્રાધ્યાપકો પણ પોતાના વિષયમાં વધુ 'ને વધુ સજ્જ થતાં રહ્યાં છે. હરણાવ, ભીમાક્ષી અને કૌશાંબી એવી ત્રણ નદીના ત્રિવેણી સંગમની પાવન ભૂમિ પર ધબકતી અને વિકસતી રહેલી આ સંસ્થા સતત પ્રવૃત્તિશીલ પણ રહી છે. સમગ્ર HNG યુનિ.માં આપણી એક માત્ર કોલેજ એવી છે જેમાં વિદ્યાર્થી-અકસ્માત વિમાની સુવિધા ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૧૯-૨૦માં NAAC cycle ૩માં સામેલ થઈ સંસ્થાએ અગાઉની cycleના પરિણામ કરતાં એક પોઇન્ટ વધુ પરિણામ હાંસલ કર્યું છે. આવી ઉજ્જવળ પરંપરા ધરાવતી આ કોલેજમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિ થઈ તેનો અહેવાલ નીચે મુજબ છે.

\* કોલેજનું તથા યુનિ.નું પરિણામ : માર્ચ-જૂન, ૨૦૨૦ :

વર્ગ	પરીક્ષામાં બેઠા	પાસ	પ્રથમ વર્ગ	કોલેજની ટકાવારી	યુનિ. ટકાવારી
બી.કોમ. સેમ. ૨	૨૭	૨૬	-	૯૬.૨૯	૯૩.૦૯
બી.કોમ. સેમ.૪	૩૩	૩૨	-	૯૬.૯૬	૯૬.૬૩

બી.કોમ. સેમ. ૬	૨૮	૧૭	૧૦	૬૦.૭૧	૭૩.૭૧
બી.એ. સેમ. ૨	૪૪૧	૪૩૬	-	૯૯.૫૪	૯૬.૫૫
બી.એ. સેમ. ૪	૩૮૩	૩૮૧	-	૯૯.૪૭	૯૬.૮૭
બી.એ. સેમ. ૬	૨૭૨	૧૪૫	૩૪	૫૪.૦૪	૫૭.૨૭
એમ.એ. સેમ. ૨	૧૪૨	૬૫	-	૪૫.૭૭	૫૯.૩૨
એમ.એ. સેમ. ૪	૩૧	૨૫	૧૯	૬૦.૯૭	૫૯.૭૫

રૂસા ગ્રાન્ટ: ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે KCG, અમદાવાદના માધ્યમથી રૂસા ભાગ : ૨, કોમ્પોનન્ટ : ૯ અંતર્ગત કોલેજ માટે રૂ. બે કરોડનું અનુદાન મંજૂર થયું છે. તે પૈકી રૂ. ૧ કરોડના ખર્ચે ગ્રંથાલયભવન, રૂ. ૬૦ લાખના ખર્ચે કોલેજ બિલ્ડીંગ રિનોવેશન તથા રૂ. ૪૦ લાખના ખર્ચે સ્માર્ટ ક્લાસ ઈન્સ્ટ્રુમેન્ટ્સ, પુસ્તકો, રમતગમતનાં સાધનો તેમજ કમ્પ્યુટર્સ વસાવવાનું આયોજન હતું. તેમાંથી વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન આયોજન પ્રમાણે ૧૦૦% કાર્ય પૂર્ણ થયું છે.

વાર્ષિક અહેવાલ (૨૦૨૦-૨૧) :

(૦૧) સંસ્કૃત વિભાગ : (વિભાગાધ્યક્ષ : ડૉ. કે. ડી. પટેલ)

- વિશેષ દિવસોની ઉજવણી કરાઈ.  
તા. ૧૨-૦૧-૨૦૨૦ના રોજ સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિ.  
તા. ૨૩-૦૧-૨૦૨૦ના રોજ સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ.  
તા. ૩૦-૦૧-૨૦૨૦ના રોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ.

\* ડૉ. કે. ડી. પટેલ :

- વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણુક પામ્યા હતા.
- વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન શ્રી બનાસકાંઠા જીલ્લા મારવાડી આંજણા પટેલ કેળવણી મંડળ થરાદના સંસ્કૃત વિષયના ઓપન ઇન્ટરવ્યુંમાં વિષય તજજ્ઞ તરીકે સેવા આપી હતી.

\* ડૉ. દિલીપ બી. સોદરવા :

- FDP - મેન્ટલ હેલ્થ વિષયપર એક ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત તા. 0૧-0૨-૨૦૨૧ થી ૧૫-0૨-૨૦૨૧ સુધી તાલીમ મેળવી.
- રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન ન્યુદિલ્હીની મેરીટ સ્કોલરશીપમાટે સંસ્થાનું રજીસ્ટ્રેશન અને ૩૨ વિદ્યાર્થીઓને ફોર્મ ભરાવ્યા.
- ઓનલાઈન કુલ ૧૦ સેમીનારમાં ભાગ લીધો.
- તા. ૧૮-૦૨-૨૦૨૦ અને તા.૧૨-૦૩-૨૦૨૧ ના રોજ નાટ્યધારાના કન્વીનર તરીકેની કામગીરી કરી.
- તા.૩૦-૦૪-૨૦૨૦ના રોજ “ગુજરાતની અસ્મિતા અને ગૌરવ સ્વરૂપ કોરોના વોરિયર્સની ભૂમિકા” પર ઓનલાઈન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.
- સેન્ટ્રલ સેક્ટર સ્કીમ સ્કોલરશીપ ફોર કોલેજ સ્ટુડન્ટ્સ - માટે સંસ્થાના રજીસ્ટ્રેશનની કામગીરી કરી અને ૬ વિદ્યાર્થીઓને ફોર્મ ભરાવ્યા.

(૦૨) અંગ્રેજી વિભાગ : (અધ્યક્ષ : ડૉ. પ્રકાશ ગજજર)

### વિભાગીય પ્રવૃત્તિ

વર્ષ 2020-21 દરમિયાન કોલેજમાં યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓ પૈકી અંગ્રેજી વિભાગના અધ્યાપકો દ્વારા નીચે મુજબના કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

- 1) BA - SEM -6 (Special English)ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં સમાવિષ્ટ “પિંજર” અને “એક ચાદર મેલી સી” ફિલ્મ ઓનલાઈન બતાવવામાં આવી .
- 2) BA - Sem-4 (Special English)ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં સમાવિષ્ટ “ગાઈડ” ફિલ્મ ઓનલાઈન બતાવવામાં આવી.
- 3) BA - Sem-6 (Special English) ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસરૂમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું,
- 4) તા: 2 ઓક્ટોબર, 2020ના દિવસે કોલેજના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સુભૂષણમતિ માતાજીએ નૈતિક મૂલ્ય વિષય ઉપર ઓનલાઈન પ્રવચન આપ્યું હતું.
- 5) ‘ઉત્તર પ્રદેશ સયંમ ભારતી પરિવાર’ દ્વારા ‘વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સંયુક્ત પરિવારની આવશ્યકતા’ વિષય ઉપર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

6) અંગ્રેજી વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કોરોનાને લીધે ઓનલાઇન વર્ગો અને ટેસ્ટ નિયમિત રીતે લેવામાં આવ્યા હતા.

અંગ્રેજી વિભાગ દ્વારા કોલેજના તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસ અને ઓનલાઇન પરીક્ષા બાબતે સતત માર્ગદર્શન અને અભ્યાસ સામગ્રી પૂરી પાડવામાં આવેલ છે.

\* ડૉ. પ્રકાશ ગજજર :

- ગુજરાત સરકારના જોબ પ્લેસમેંટ ફેરમાં ભાગ લેતા વિદ્યાર્થીઓ માટે કોલેજની કારકિર્દી માર્ગદર્શન સમિતિ & જોબ પ્લેસમેંટ સેલ દ્વારા આયોજિત એકદિવસીય વર્કશોપમાં વિદ્યાર્થીઓને CV રાઇટિંગ, અરજી લેખન અને ઈન્ટરવ્યું અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
- કોરોના કાળ દરમિયાન અંગ્રેજી તેમજ અન્ય 5 ઓનલાઇન સેમિનાર – વર્કશોપમાં ભાગ લીધો.
- સુભૂષણમતિ માતાજી દ્વારા આયોજિત રાષ્ટ્રીય નિબંધ લેખનસ્પર્ધામાં 80 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાંથી 15 વિદ્યાર્થીઓ વિજેતા થયા.
- કોરોના દરમિયાન ઓફલાઇન ક્લાસ બંધ હોવાથી 'આદર્શ શિક્ષણ અને નૈતિક મૂલ્યો' વિષય ઉપર સુભૂષણમતિ માતાજીના ઓનલાઇન વ્યાખ્યાન નું આયોજન કર્યું.

\* પ્રા. આનંદ એસ. પટેલ :

- પ્રા. આનંદભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાયમી નિમણૂક મેળવી.

\* પ્રા. જીગર ખરાડી :

- સમગ્ર વર્ષ દરમિયાન કોવિડ-૧૯ ને લીધે ઓનલાઇન વર્કશોપ / સેમિનાર / ક્વિઝ વગેરેમાં ભાગ લીધો છે.

(૦૩) ગુજરાતી વિભાગ : (વિભાગાધ્યક્ષ : ડૉ. મંજુ ખેર)

1. આ વર્ષે ડૉ.મંજુ ખેર ગુજરાતી વિભાગના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો.
2. ડૉ.મંજુ ખેરના માર્ગદર્શન તળે ડૉ. વિક્રમ સોલંકી અને ભૂમિ સુતરિયાએ એમ.ફિલ. પૂર્ણ કર્યું.
3. ડૉ.મંજુ ખેરના માર્ગદર્શન તળે ડૉ.ધારા પટેલે આ વર્ષે પીએચ.ડી.ની પદવી મેળવી.
4. વર્ષ દરમિયાન બે ઈન્ટરનેશનલ, ત્રણ નેશનલ તેમજ ત્રણ રાજ્યકક્ષાના ઓનલાઇન સેમિનાર,વેબિનારમાં ભાગ લીધો. એક શોધપત્ર પણ રજૂ કર્યું હતું.

5. તારીખ ૨૮-૦૯-૨૦ ના રોજ એસ.બી.મહિલા કોલેજ, હિંમતનગર ખાતે કવિ ઉશનસના જન્મજયંતિ પ્રસંગે એક દિવસીય સેમિનારમાં 'કવિ ઉશનસના જીવન-કવન' વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.
6. તારીખ ૧૮-૦૨-૨૧ના રોજ કે.આર. કટારા આર્ટ્સ કોલેજ, શામળાજી ખાતે 'સાહિત્ય અને શિક્ષણ' વિષય પર ઓનલાઈન તજજ્ઞ વ્યાખ્યાન આપ્યું.

(૦૪) હિન્દી વિભાગ : (વિભાગાધ્યક્ષ : ડૉ. જી. એસ. રાઠવા)

- તા. ૩૧.૦૭.૨૦૨૧ના રોજ પ્રેમચંદ જયંતિની ઉજવણી કરવામાં આવી.
- તા. ૧૪.૦૯.૨૦૨૧ના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી.

(૦૫) અર્થશાસ્ત્ર વિભાગ : (વિભાગાધ્યક્ષ : પ્રિ. એન. ડી. પટેલ)

વિભાગીય પ્રવૃત્તિ

અનું.	વિગત	તારીખ
૧.	જીલ્લા સહકારી સંઘ અને કોલેજના ઉપક્રમે યુવક સહકારી તાલીમવર્ગનું આયોજન	૨૬.૧૦.૨૦૨૦ થી ૩૧.૧૦.૨૦૨૦
૨.	HPCL કંપની અને કોલેજના ઉપક્રમે ' સતર્ક ભારત ' વિશે નિબંધ સ્પર્ધા યોજાઈ	૩.૧૧.૨૦૨૦
૩.	HPCL કંપની અને કોલેજના ઉપક્રમે 'ઉર્જા જાગૃતિ ' વિશે ક્વીઝનું આયોજન	નવેમ્બર-૨૦૨૦
૪.	TCS-TATA કંપની અને કોલેજના ઉપક્રમે online રોજગારલક્ષી તાલીમવર્ગ યોજાયો.	નવેમ્બર-૨૦૨૦થી જાન્યુઆરી-૨૦૨૧
૫.	TATA લાઈફ ઇન્સ્યોરન્સ કંપની અને અર્થશાસ્ત્ર વિભાગના ઉપક્રમે ફાઈનાન્સીયલ અવેરનેસ અંગેનો સેમીનાર	૪.૩.૨૦૨૧

પ્રિ. એન.ડી. પટેલ

- વર્ષ દરમિયાન યુની.ની વિવિધ LIC કમિટીના સભ્ય તરીકે કાર્ય કર્યું.
- અર્થશાસ્ત્ર વિષય સંબંધિત બે સેમિનારોમાં જોડાયા.

ડો.રોહિત જે દેસાઈ

અનું	વિગત	તારીખ
૧.	ડો.રોહિત દેસાઈના PHDના ૫ વિદ્યાર્થીઓને કુલ રૂ.૨૦ લાખ(૧ વિદ્યાર્થીના ૪ લાખ)ની સંશોધન ગ્રાન્ટ ગુજરાત સરકારની સંશોધન અંગેની 'શોધ'-યોજના અંતર્ગત KCG થકી પ્રાપ્ત થઈ.	૧.૧.૨૦૨૦ થી ૩૧.૧.૨૦૨૧
૨.	હાર્વડ યુની.નો 'એન્ટરપ્રીનરશીપ ઇન ઈમરજિંગ ઇકોનોમી' એ વિષય પર ત્રિમાસિક સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કર્યો.	૨૦૨૦
૩.	HNG Univના પ્રથમ વર્ષ BA સેમ-૧&૨ પેપર-૧ ને અનુલક્ષી 'એકમલક્ષી અર્થશાસ્ત્ર 'પુસ્તક પ્રાથમ પ્રકાશન, અમદાવાદ થકી પ્રકાશિત	ઓગષ્ટ-૨૦૨૦
૪.	HNG Univના પ્રથમ વર્ષ BA સેમ-૧&૨ પેપર-૨ને અનુલક્ષી નાણું અને બેંકિંગ 'પુસ્તક પ્રાથમ પ્રકાશન અમદાવાદ થકી પ્રકાશિત .	ઓગષ્ટ-૨૦૨૦
૫.	ગાંધીદર્શન વિશે કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડાના ખેડબ્રહ્મા કેન્દ્રના ઉપક્રમે વ્યાખ્યાન	૨.૧૦.૨૦૨૦
૬.	હેમ.ઉ.ગુ.યુની.ની અર્થશાસ્ત્ર વિષયની અભ્યાસ સમિતિ (BOS)માં કો-ઓપ્ટ સભ્ય તરીકે ત્રણ વર્ષ માટે નિયુક્ત	૧૫.૧૨.૨૦૨૦

શ્રી.શક્તિસિંહ સોલંકી

અનું.	વિગત	તારીખ
૧.	પ્રા.શક્તિસિંહ સોલંકીને PHD અભ્યાસના સંદર્ભમાં ગુજરાત સરકારની સંશોધન અંગેની 'શોધ'-યોજના અંતર્ગત KCG થકી ૪ લાખનું અનુદાન પ્રાપ્ત થયું.	૧.૧.૨૦૨૦ થી ૩૧.૧.૨૦૨૧

૨.	ઇન્ટરનેશનલ પિયર રીવ્યુ જનરલ 'આયુધ'માં 'આદિવાસી વિસ્તારમાં પ્રવાસન વિકાસ'એ વિશે અભ્યાસલેખ પ્રકાશિત થયો.	ઓક્ટોબર-૨૦૨૦
૩.	ઇન્ટરનેશનલ જનરલ ઓફ રીસર્ચ 'RAIJMR' માં 'ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પ્રવાસન વિકાસ:સમસ્યાઓ અને સંભવાના'એ વિશે અભ્યાસલેખ પ્રકાશિત થયો.	ડિસેમ્બર-૨૦૨૧

(૦૬) સમાજશાસ્ત્ર વિભાગ : (વિભાગાધ્યક્ષ : ડૉ. વી. સી. નિનામા)

\* ડૉ. વી. સી. નિનામા :

- તા. ૧૩-૦૯-૨૦૨૦ના રોજ આર્ટસ અને કોમર્સ કોલેજ, બાસ્પા (સમી) ખાતેના અધ્યાપકના ઇન્ટરવ્યુમાં યુનિવર્સિટીના વિષય તજજ્ઞ તરીકે સેવા આપી.
- તા. ૨૦-૧૨-૨૦૨૦ના રોજ રાજેશ્વર આર્ટસ કોલેજ, થરાદ ખાતેના અધ્યાપકના ઇન્ટરવ્યુમાં યુનિવર્સિટીના વિષય તજજ્ઞ તરીકે સેવા આપી.
- તા. ૨૭-૧૨-૨૦૨૦ના રોજ સરસ્વતી આર્ટસ કોલેજ, થરાદ ખાતેના અધ્યાપકના ઇન્ટરવ્યુમાં યુનિવર્સિટીના વિષય તજજ્ઞ તરીકે સેવા આપી.
- તા.૨૪-૦૫-૨૦૨૦ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે યોજાયેલ નોલેજ ક્વીઝમાં ભાગ લીધો.
- તા. ૨૬-૦૫-૨૦૨૦ના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે COVID-19: Socio-cultural Impacts નેશનલ વેબીનારમાં ભાગ લીધો.
- તા. ૦૭-૦૬-૨૦૨૦ના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે Human Resources વેબીનારમાં ભાગ લીધો.
- તા. ૦૨-૦૬-૨૦૨૦ના રોજ એમ.એમ.ઘોડાસરા કોલેજ, જુનાગઢ ખાતે E-learning platform અંગેના નેશનલ વેબીનારમાં ભાગ લીધો.
- તા.૧૩-૦૬-૨૦૨૦ના રોજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, મોટાકોઢા (સુરત) ખાતે યોજાયેલ નોલેજ ક્વીઝમાં ભાગ લીધો.

(૦૭) મનોવિજ્ઞાન વિભાગ : (વિભાગાધ્યક્ષ : ડૉ. એન. એમ. તાજપુરિઆ)

- ડૉ. નિશા એમ તાજપુરીઆના માર્ગદર્શન હેઠળ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી બે વિદ્યાર્થીઓ એમ.ફિલ. થયા.
- રજત પબ્લીકેશન ન્યુ દિલ્હી ધ્વારા “**Applied Cognitive Psychology**” પુસ્તક પ્રકાશિત થયું.

(૦૮) કોમર્સ વિભાગ : (વિભાગાધ્યક્ષ : ડૉ. એમ. બી. પરમાર)

#### વિભાગિય પ્રવૃત્તિ:

1. 03-06-2020 થી 10-06-2020, 7 દિવસનો કોમર્સ વિભાગ દ્વારા આખા ગુજરાતમાંના વિદ્યાર્થીઓ/અધ્યાપકો માટે ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશન ખુલ્લો મુકાયો, જેમાં ગુજરાતની જુદી જુદી કોલેજોમાંથી કુલ 496 અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં 50% થી વધુ ગુણ મેળવનારને ઈ-સર્ટિફિકેટ આપવામાં આવ્યા.
2. 17-09-2020ના રોજ Microsoft teams દ્વારા “કરવેરા પરિચયમાં GST” પર સી.એ. પલ્લવ મહેતા- અમદાવાદ દ્વારા ઓનલાઈન એક્સપર્ટ લેક્ચર ગોઠવાયું.

#### વ્યક્તિગત પ્રવૃત્તિઓ:

#### ડૉ. એમ. બી. પરમાર:

1. તા.1-12-2020ના રોજ HNGU, પાટણમાં બોર્ડ ઓફ સ્ટડીના સભ્ય તરીકે નિમણુક કરવામાં આવી.

#### આર્ટીકલ:

- માર્ચ-2020ના રોજ KCG, ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, ગુજરાત સરકાર, અમદાવાદના જરનલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં “Relationship Between EPS And Market Price: The Study Of Top 5 Ceramic And Granite Companies” નામે પેપર પબ્લિશ થયું.
- મે-2020ના રોજ RET Academy for international Journals of Multidisciplinary Research, મેહસાણામાં “Digital Platform for Researcher and Ethical Consideration” નામે પેપર પબ્લિશ થયું.
- Gov. of Gujarat KCG દ્વારા તા. September 8, 2020 થી October 23, 2020 દરમિયાન આયોજિત સર્ટીફિકેટ કોર્સ કર્યો.

#### સેમિનાર/ઈ-સેમિનાર:



- વર્ષ 2020-21માં આયોજિત નેશનલ, ઇન્ટરનેશનલ અને સ્થાનિક કક્ષાએ યોજાયેલ 12 વેબિનારમાં ભાગ લીધો.

#### ડૉ. કલ્પેશ સુથાર:

#### આર્ટીકલ:

- તા.22-04-2020ના રોજ RET Academy for international Journals of Multidisciplinary Research, મેહસાણામાં “COVID-19ની ભારતિય અર્થતંત્ર પર અસરોના પરિપ્રેક્ષમાં સમિક્ષા” નામે પેપર પબ્લિશ થયું.

#### સેમિનાર/વેબિનાર:

- તા.22-04-2020ના રોજ RET Academy for international Journals of Multidisciplinary Research, રૂઢ્ર એજ્યુકેશન ટ્રસ્ટ, મેહસાણામાં ઈ-સેમિનાર યોજાયો, જેમાં “COVID-19ની ભારતિય અર્થતંત્ર પર અસરોના પરિપ્રેક્ષમાં સમિક્ષા” નામે પેપર રજૂ કર્યું.
- તા.01-05-2020 થી 04-05-2020 સુધી સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન આયોજિત ચાર દિવસીય કોર્સ, “Research Methods”માં ભાગ લીધો.
- તા.11-05-2020 થી 15-05-2020 સુધી ઇન્ડિયન એકાઉન્ટિંગ એસોસિએશન અને ઇન્ડિયન એકેડેમિક રિસર્ચ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન આયોજિત પાંચ દિવસીય કોર્સ “Futuristics Accounting” માં ભાગ લીધો અને “A” ગ્રેડ થી પરિણામ પ્રાપ્ત કર્યું.
- ઉપરાંત વર્ષ 2020-21 દરમિયાન 5 ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્થાનિક વેબિનાર અને 20થી વધુ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો.

#### ટ્રેઈનીંગ પ્રોગ્રામ:

- 25/26/27-06-2020ના રોજ ડી ડી ઠાકર આર્ટ્સ એન્ડ કે જે પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે “Google Meet દ્વારા ઓનલાઈન શૈક્ષણિક કાર્ય” અંગે અધ્યાપકોને ટ્રેઈનીંગ આપી.
- 30-06-2020ના રોજ વડાલી આર્ટ્સ કોલેજ ખાતે “Google Meet દ્વારા ઓનલાઈન શૈક્ષણિક કાર્ય” અંગે અધ્યાપકોને ટ્રેઈનીંગ આપી.
- 10/11-07-2020ના રોજ ડી ડી ઠાકર આર્ટ્સ એન્ડ કે જે પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે “Microsoft teams દ્વારા ઓનલાઈન શૈક્ષણિક પ્રવૃત્તિઓ” અંગે અધ્યાપકોને ટ્રેઈનીંગ આપી.

- 20/07/2020ના રોજ વડાલી આર્ટ્સ કોલેજ, વડાલી ખાતે “Microsoft teams દ્વારા ઓનલાઈન શૈક્ષણિક પ્રવૃત્તિઓ” અંગે અધ્યાપકોને ટ્રેઈનીંગ આપી.
- 21/07/2020ના રોજ વિજયનગર આર્ટ્સ કોલેજ, વિજયનગર ખાતે “Microsoft teams દ્વારા ઓનલાઈન શૈક્ષણિક પ્રવૃત્તિઓ” અંગે અધ્યાપકોને ટ્રેઈનીંગ આપી.
- 25/07/2020ના રોજ ડી ડી ઠાકર આર્ટ્સ એન્ડ કે જે પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે “Microsoft teams દ્વારા અસાઈમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન પદ્ધતિ” અંગે અધ્યાપકોને ટ્રેઈનીંગ આપી.

આ ઉપરાંત કોલેજ થકી થયેલ દરેક ઓનલાઈન પ્રોગ્રામમાં ઓપરેટરની ભૂમિકા ભજવી.

(૦૯) ગ્રંથાલય વિભાગ : (ગ્રંથપાલ : શ્રી હરપાલસિંહ એચ. ચૌહાણ)

- વર્ષની શરૂઆતમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ગ્રંથાલયનું અભ્યાસ જીવનમાં મહત્વ વિષય પર વ્યાખ્યાન આપી ગ્રંથાલય ઓરિએન્ટેશન કરવામાં આવ્યું.
- ગ્રંથાલયમાં વર્ષ દરમિયાન કુલ રૂ.૩,૨૭,૧૦૫ની કિંમતના ૨૬૦૨ પુસ્તકોનો વસાવવામાં આવ્યા.
- ડિજિટલ લાયબ્રેરી અંતર્ગત INFLIBINET ના N-LIST પ્રોગ્રામ અંતર્ગત ૬૦૦૦ ઈ-જર્નલ્સ અને ૩,૧૩,૫૦૦ ઈ-બુક્સ ઓનલાઈન ઉપલબ્ધ છે.
- વર્ષ દરમિયાન કોરોનાના સમયમાં અભ્યાસક્રમ લક્ષી સાહિત્ય પેપર સેટ અન્ય પરીક્ષા લક્ષી સાહિત્ય વગેરે સ્કેન કરી વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને ઓનલાઈન વેબસાઈટ, વોટ્સ-એપ વગેરે સોસિઅલ મિડિયાના માધ્યમથી ગ્રંથાલય દ્વારા પહોચાડવામાં આવ્યા હતા.
- વર્ષ દરમિયાન બી.કોમ.ના ૧૦૦ ટકા અને બી.એ.ના ૬૦ ટકા વિદ્યાર્થીઓને બુક-બેંક અંતર્ગત પાઠ્ય પુસ્તકો આપવામાં આવ્યા હતા.
- વર્ષ દરમિયાન ૧૧ પી.એચ.ડી. વિદ્યાર્થીઓને તેમના સંશોધન કાર્ય માટે ગ્રંથાલયનો ઉપયોગ કર્યો હતો.
- પુસ્તક પ્રદર્શન.  
તા. ૧૪-૦૯-૨૦૨૦ના રોજ હિન્દી દિવસના ઉપક્રમે ઓનલાઈન પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

- શ્રી હરપાલસિંહ ચૌહાણ:

તા.૧૨-૦૯-૨૦૨૦થી ૨૪-૧૦-૨૦૨૦ દરમિયાન ઓનલાઈન NISE સર્ટિફિકેટ કોર્સ કર્યો હતો.

ચાલુ વર્ષે “Financial Management of College Libraries Affiliated to Hemchandracharya North Gujarat University, Patan: An Analytical Study” એ વિષય પર ડૉ.કિરીટ એચ. શુક્લના માર્ગદર્શન હેઠળ ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદમાંથી ડોક્ટરેટની પદવી મેળવી.

(૧૦) IQAC (Internal Quality Assesement Cell) : (સંયોજક : ડૉ. પ્રકાશભાઈ ગજજર)

IQAC રિપોર્ટ સબમિટ કર્યો અને કો-ઓર્ડિનેટર તરીકે વિવિધ કામગીરી કરી

**(૧૧) NCC વિભાગ :** (પ્રોગ્રામ ઓફિસર : ડૉ. દિલીપ બી. સોંદરવા)

- ચાલુ વર્ષે કુલ ૫૫ કેડેટ્સ જોડાયા
- તા. ૧૩-૧૦-૨૦૨૦ના રોજ પ્રથમ વર્ષના કેડેટમિત્રોની ભરતી કરી.
- તા. ૨૧-૦૯-૨૦૨૦ના રોજ ફિટ ઈન્ડિયા પ્રોગ્રામ / ફીડમ રેલીનું આયોજન કરાયું.
- તા. ૨૯-૧૨-૨૦૨૦ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
- તા. ૨૧-૦૬-૨૦૨૦ના રોજ “૨૧મિ જુન, આંતર રાષ્ટ્રીય યોગદિવસ”ની ઉજવણી કરાઇ.
- તા. ૧૫-૦૮-૨૦૨૦ના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.
- તા. ૨૬-૦૧-૨૦૨૦ના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.
- કુલ ૪૩ કેડેટ મિત્રોએ એન્યુયલ ટ્રેનીંગ કેમ્પમાંમાં ભાગ લીધો. રાજેન્દ્રનગર મુદ્રેનીંગ લીધી
  - કુલ ૨૬ – કેડેટ મિત્રોએ તા. ૦૭-૦૨-૨૦૨૧ થી ૧૦-૦૨-૨૦૨૧ સુધી બી. સર્ટિફિકેટ અંગેની તાલીમ મેળવી.
  - કુલ ૧૭ –કેડેટ મિત્રોએ તા. ૧૯-૦૨-૨૦૨૧ થી ૨૪-૦૨-૨૦૨૧ સુધી સી. સર્ટિફિકેટ અંગેની તાલીમ મેળવી.
- ડૉ. દિલીપ કુમારે રાજેન્દ્રનગર મુકામે તા. ૦૭-૦૨-૨૦૨૧ થી ૧૦-૦૨-૨૦૨૧ સુધી કેમ્પ-એ.એન.ઓ. તરીકે ફરજ બજાવી.
- કુલ ૪૩ કેડેટ મિત્રોએ તા. ૨૦-૦૬-૨૦૨૧ના રોજ બી. સર્ટિફિકેટ અને તા. ૨૭-૦૬-૨૦૨૧ના રોજ સી. સર્ટિફિકેટની પરીક્ષા આપીઆપી.
  - ડૉ. દિલીપ કુમાર બી. સોંદરવાએ બેજીક ઓફ કોવિડ - 19, બેજીક ઓફ ડીજાસ્ટર રિસ્ક અને કોવિડ 19 રિસ્પોન્સિવ બિહેવિયર એમ ત્રણ પ્રકારની તાલીમ ઓનલાઇન મેળવી.

**(૧૨) NSS વિભાગ :** (પ્રોગ્રામ ઓફિસર : ડૉ. જી. એસ. રાઠવા તથા ડૉ. કે. ડી. પટેલ )

ડી.ડી.ઠાકર આર્ટ્સ અને કે.જી.પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના એન.એસ.એસ. વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન થયેલ પ્રવૃત્તિગત અહેવાલ આ મુજબ છે. કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજનાના કુલ બે યુનિટ ચાલે છે. જેમાં બે પ્રોગ્રામ ઓફિસર્સ અને કુલ ૨૦૦ સ્વયંસેવકો સ્વચ્છતા સાથે સંલગ્ન સેવારત પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. આ વર્ષમાં આખું વિશ્વ કોરોના મહામારી (COVID-19)ના સંક્રમણમાં સપડાયેલ હોઈ સેવારત પ્રવૃત્તિઓમાં અનેક પડકારો વચ્ચે પણ સ્વયંસેવકોએ કાર્ય કર્યું છે જે બિરદાવવા લાયક છે.

ક્રમ	તારીખ	વિગત
૧	૨૧.૦૬.૨૦૨૦	યોગ દિવસ (કોરોના મહામારીને ધ્યાનમાં રાખી તેમજ લોકડાઉનની સ્થિતિમાં પરિવાર સાથે યોગાસન)
૨	૧૭.૦૭.૨૦૨૦	ઓનલાઈન ગુરુપર્વ કાર્યક્રમ
૩	૧૫.૦૮.૨૦૧૯	સ્વતંત્રતા પર્વ
૪	૨૩.૦૮.૨૦૧૮	વિદ્યાર્થી વોલેન્ટીયર પ્રજાપતિ મેહુલકુમાર હિરાભાઈને મામલતદાર ખેડબ્રહ્મા દ્વારા ૨૦૨૦-૨૧ના વર્ષ માટે કોલેજ કક્ષાએ મતદાતા મિત્ર તરીકેની નિમણુંક કરવામાં આવી.
૫	૨૫.૦૮.૨૦૨૦	ઓનલાઈન ઓરિએન્ટેશન કાર્યક્રમ
૬	૦૭.૧૨.૨૦૨૦	વિદ્યાર્થી વોલેન્ટીયર પ્રજાપતિ મેહુલકુમાર હિરાભાઈને આરોગ્ય વિભાગ, ખેડબ્રહ્મા દ્વારા ૨૦૨૦-૨૧ના વર્ષ Covid - 19 Special Task Force અંતર્ગત નિમણુંક કરવામાં આવી.
૭	૦૮.૦૯.૨૦૨૦	કોરોના ચેકઅપ કાર્યક્રમ
૮	૨૮.૦૯.૨૦૨૦	NSS પ્રોગ્રામ ઓફિસર - સ્વયં સેવકની ભૂમિકા કોવિડ - ૧૯ના સંદર્ભે ઓનલાઈન કાર્યશાળા
૯	૦૧.૧૦.૨૦૨૦	હેમ.ઉત્તર ગુજરાત યુનિ. પાટણ દ્વારા મહાત્માગાંધી ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત વેબીનારમાં NSS સ્વયંસેવકોએ ભાગ લીધો.
૧૦	૦૫.૧૦.૨૦૨૦	'ગાંધી જયંતિ' નિમિત્તે ગાંધી વિચારની પ્રાસંગિકતાને લઈને નિબંધ સ્પર્ધા
૧૧	૨૦.૧૦.૨૦	'ફૂડ એન્ડ ન્યુટ્રીશન' કાર્યક્રમ
૧૨	૨૬.૧૧.૨૦	સંવિધાન દિવસ

૧૩	૮.૧૨.૨૦	“યુવા મતદાર મહોત્સવ – ૨૦૨૦”
૧૪	૧૫.૧૨.૨૦	‘ડ્રગ્સનો દુરુપયોગ તથા માનસિક સ્વાસ્થ્ય’ વેબિનારમાં ભાગ લીધો.
૧૫	૨૭.૧૨.૨૦૧૯	નૈતિક શિક્ષણ અને વ્યસન મુક્તિ
૧૬	૨૫.૧.૨૧	કોલેજ કક્ષાએ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ - ૨૦૨૧’ની ઉજવણી કરવામાં આવી હતી. તથા આ નિમિત્તે પ્રાંત ઓફિસરશ્રી હાર્દ યુ.જોશી, મામલતદારશ્રી જી.ડી.ગમાર, નાયબ મામલતદારશ્રી જયેશ સુતરીયા, આચાર્યશ્રી એન.ડી.પટેલ, પ્રોગામ ઓફિસરશ્રી ડૉ.જે.એસ.રાઠવા તથા ડૉ.કે.ડી.પટેલ વગેરે ઉપસ્થિત રહી ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ દિવસની માહિતી આપી હતી. આવ્યા હતા.
૧૭	૨૬.૧.૨૧	પ્રજાસત્તાક પર્વ
૧૮	૧૮.૨.૨૧	મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ
૧૯	૨૪.૨.૨૧	વેબિનાર
૨૦	૮.૩.૨૧	બ્રહ્મવાવની સ્વચ્છતા
૨૧	૧૩.૩.૨૧	સ્ટાર્ટઅપ શિબિર
૨૨	૧૬.૩.૨૦૨૧થી ૩૧.૦૩.૨૦૨૧	પોષણક્ષમ પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ
૨૩	૨૫.૦૩.૨૦૨૧	જલશક્તિ અભિયાન
૨૪		કોવિડ - ૧૯ વેક્સિન (ટીકાકરણ) કાર્યક્રમ
૨૫	૭.૪.૨૧	‘પરીક્ષા પે ચર્યા’ કાર્યક્રમ ૭.૪.૨૧
૨૬	૧૧ થી ૧૪.૦૪.૨૦૨૧	કોરોના રસી અંગે જાગૃતિકરણ અભિયાન

(૧૩) કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર : (સંયોજક : ડૉ. રોહિત દેસાઈ તથા શ્રી હરપાલસિંહ ચૌહાણ)

વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માર્ગદર્શન મળી રહે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે દર શનિવારે જનરલ નોલેજના વર્ગો લેવામાં આવે છે, તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. તેમજ અન્ય માહિતી આપવામાં આવી હતી. વર્ગોનું આયોજન ડો.આર.જે.દેસાઈ, ડો.એચ.એચ.ચૌહાણે કર્યું હતું.

**જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન:**

જ્ઞાન-ધારા અંતર્ગત તા.૧૩-૦૩-૨૦૨૧ના રોજ ૯.૩૦ કલાકે જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૬૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું આયોજન ડો.એચ.એચ.ચૌહાણ અને ડો.આર.જે.દેસાઈએ કર્યું હતું.

**સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનું આયોજન:**

તા.૧-૦૨-૨૦૨૧ થી ૧૫-૦૩-૨૦૨૧ સુધી ગુજરાત સરકાર જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને કોલેજના સંયુક્ત ઉપક્રમે પોલીસ ભરતી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૬૮ વિદ્યાર્થીઓએ તાલીમ લીધી હતી.

**સેમીનાર / શિબિર / વર્કશોપ:**

**૧. સી.વી.રાઈટીંગ સ્કીલ વર્કશોપ:**

તા. ૧૭-૦૩-૨૦૨૧ના રોજ ઉદીશા પ્લેસમેન્ટ સેલના ઉપક્રમે ખેડબ્રહ્મા કોલેજ ખતે સી.વી. રાઈટીંગ સ્કીલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં ભાગ લેનાર ૪૦ વિદ્યાર્થીઓને તજજ્ઞ તરીકે ડો.પ્રો. પ્રકાશભાઈ ગજ્જરે (અંગ્રેજી વિભાગ) સેવા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઉદીશા ક્લબના કો-ઓર્ડિનેટર ડો.એમ.બી, પરમાર અને ડો.એચ.એચ.ચૌહાણે કર્યું હતું.

**૨. સ્ટાર્ટઅપ ઇન્ડિયા શિબિર:**

તા.૧૩-૦૩-૨૦૨૧ના રોજ HNGU, પાટણ અને કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું કોલેજ સંચાલન શિબિર સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

**૩.ઉદીશા અંતર્ગત જોબ-પ્લેસમેન્ટ ફેર:**

તા.૧૮-૦૩-૨૦૨૧ના રોજ રાજ્ય સરકાર દ્વારા જોબ-પ્લેસમેન્ટ ફેર-૨૦૨૧નું આયોજન પોલોટેકનીક કોલેજ હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા વર્ષાના ૩૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમના કેમરોલ

કવાટેઝ લી. કંપનીમાં એક અને વેલ્થટ્રેઈન કંપનીમાં પાંચ અને કુલ છ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.એમ.બી.પરમાર, ડો.એચ.એચ.ચૌહાણ અને પ્રા.શક્તિસિંહ સોલંકીએ કર્યું હતું.

(૧૪) BAOU (બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી) કેન્દ્ર : (સંચાલક : ડો.એચ.એચ ચૌહાણ)

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કેન્દ્રમાં ચાલતા કોર્સ અને સંખ્યા:

ક્રમ	કક્ષા	કોર્સ	સંખ્યા
૧	સ્નાતક	બી.એ.	૧૩૫
		બી.કોમ.	૫
		બેચલર ઓફ લાયબ્રેરી સાયંસ	૨૧
૨	અનુસ્નાતક	એમ.એ.	૩૦
		એમ.કોમ.	-
		માસ્ટર ઓફ લાયબ્રેરી સાયંસ	૧૨
૩	ડિપ્લોમા કોર્સ	-	-
૪	સર્ટિફિકેટ કોર્સ	CCC-કમ્પ્યુટર	૧૨
		CJMC	૧
		CFN	૨
		CMT	૧
		CCWA	૨
		કુલ	૨૧૧

(૧૫) ટ્રાઇબલ રીસર્ચ સેન્ટર: (સંયોજક: ડો. આર. જે. દેસાઈ)

અનું.	વિગત
૧.	વિશ્વ, દેશ, રાજ્ય, જીલ્લા અને તાલુકા કક્ષાની આદિવાસી વસ્તી સંદર્ભિત પ્રાથમિક માહિતી આપતા ચાર્ટ તૈયાર કરાયા
૨.	આદિવાસી તેમજ અન્ય સંશોધનને ઉપયોગી થીસીસ, રિપોર્ટો, પુસ્તકો વગેરેનું ભૌતિક તેમજ E-કોપી સ્વરૂપે સંગ્રહ

(૧૬)સપ્તધારા : (સંયોજક : ડૉ.એમ.બી.પરમાર)

તા. ૧૨/૧૩-૦૩-૨૦૨૧ના રોજ સપ્તધારા અંતર્ગત વિવિધ ધારાઓમાં સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને સાતે ધારાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને રોકડ તેમજ પ્રમાણપત્રો પ્રોત્સાહક ઇનામ તરીકે એનાયત કરવામાં આવ્યા હતા.

(૧૭) વિદ્યાર્થી-પરિષદ : (સંયોજક : ડૉ. કે. ડી. પટેલ)

- તા.૧૩-૦૨-૨૦૨૧ના રોજ બી.એ.સેમ-૧ અને બી.કોમ.સેમ-૧ના વિદ્યાર્થીઓ માટે પરિચય બેઠક યોજવામાં આવી. જેમાં કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી.
- તા. ૦૪-૦૭-૨૦૨૦ના રોજ ગુરુપર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં વક્તા તરીકે માણસા કોલેજના પ્રા. વિક્રમ જોષીએ ઓનલાઈન વ્યાખ્યાન આપ્યું અહતું.
- તા. ૩૧-૧૨-૨૦૨૦ના રોજ હંસા નિરંજન લાલભાઈ ટ્રસ્ટ તેમજ કોલેજના સંયુક્ત ઉપક્રમે ઇનામ-પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાયો.
- તા. ૧૦-૦૯-૨૦૨૦ના રોજ ઓનલાઈન સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે પ્રેણાનાત્મક પુસ્તક, ડાયરી અને પેન ભેટ સ્વરૂપે આપી હતી.

-----

વિદ્યાર્થી-પરિષદ

આચાર્યશ્રી

૧. ડૉ. કે. ડી. પટેલ (ઇન્ચાર્જ)

ડૉ. વી. સી. નિનામા

૨. ડૉ. એમ. બી. પરમાર

૩. ડૉ. આર. જે. દેસાઈ



૪. ડૉ. ઁચ. ઁચ. યૌહાણ

૫. ડૉ. કે. યુ. સુથાર

૬. શ્રી ઁસ. જી. યૌહાણ

મે ૨૦૨૧થી ડો.એચ.એચ.ચૌહાણને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, કેન્દ્રના સંયોજક તરીકે નિમણુક કરવામાં આવી.

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કેન્દ્રમાં ચાલતા કોર્સ અને સંખ્યા:

ક્રમ	કક્ષા	કોર્સ	સંખ્યા
	સ્નાતક	બી.એ.	૧૪૭
		બી.કોમ.	૫
		બેચલર ઓફ લાયબ્રેરી સાયંસ	૧
	અનુસ્નાતક	એમ.એ.	૨૪
		એમ.કોમ.	૨
		માસ્ટર ઓફ લાયબ્રેરી સાયંસ	-
	ડિપ્લોમા કોર્સ	-	-
	સર્ટિફિકેટ કોર્સ	CCC-કમ્પ્યુટર	૨૫
		CJMC	-
		CFN	-
		CMT	૨

		CCWA	૮
		કુલ	૨૧૪

**વિશેષ સિદ્ધિ:**

- ચાલુ વર્ષે ખેડબ્રહ્મા કોલેજ કેન્દ્રના બે વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ તેમજ એક વિદ્યાર્થીએ સિલ્વર મેડલ મેળવી સમગ્ર ગુજરાતમાં કોલેજનું નામ રોશન કર્યું.
- ત્રણે વિદ્યાર્થીઓને BAOU, અમદાવાદ ખાતે મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીની હાજરીમાં મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રતના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.



  
**Principal**  
**D.D. Thakar Arts &**  
**K.J. Patel Commerce College**  
**Khedbrahma-383255**